

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

વર્ષ ૨૦૧૫-૧૬ માં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે

ઓફ-લાઈન અરજી મંગાવવા બાબતે જરૂરી સુચનાઓ

ઓફ-લાઈન અરજી કરવાની છેલ્લી તા. ૧૮/૦૮/૨૦૧૭

(૧)	<p>વર્ષ ૨૦૧૫-૧૬ માં પ્રવેશ મેળવેલ અને નીચે મુજબ પરસેન્ટાઈલ અને વાલીની આવક મર્યાદાના ધોરણો સંતોષતા હોય કે જેઓએ અગાઉ ઓન-લાઈન એપ્લીકેશન કરેલ નથી તેવા વિદ્યાર્થીઓએ જ ઓફલાઈન અરજી કરવાની રહેશે.</p> <p>(અ) વિદ્યાર્થીએ માન્ય બોર્ડની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહની પરીક્ષા ૯૦ કે તેથી વધુ પરસેન્ટાઈલ સાથે પાસ કરી સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય અથવા માન્ય બોર્ડની ધોરણ-૧૦ ની પરીક્ષા ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઈલ સાથે પાસ કરી ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય અથવા માન્ય યુનિવર્સિટી/બોર્ડની ડીપ્લોમાની પરીક્ષા ૬૫ કે તેથી વધુ ટકા સાથે પાસ કરી ડીગ્રી અભ્યાસક્રમમાં (ડી ટુ ડી) પ્રવેશ મેળવેલ હોય</p> <p>(બ) વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ સુધીની હોય</p>
(૨)	<p>૨૦૧૫-૧૬ ના વર્ષના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓફ-લાઈન અરજી કરવાની છેલ્લી તા. ૧૮/૦૮/૨૦૧૭ રહેશે.</p>
(૩)	<p>ઓફ-લાઈન અરજીનો નમુનો વેબપોર્ટલ mysy.guj.nic.in પર ઉપલબ્ધ છે. વેબપોર્ટલ પર ડીગ્રી અભ્યાસક્રમો માટે , ડીપ્લોમા અભ્યાસક્રમો માટે તથા ડી ટુ ડી અભ્યાસક્રમો માટે અલગ-અલગ ફોર્મ આપેલ છે. વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમને લગતું ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી જરૂરી વિગતો સાથે ઓફલાઈન અરજી કરવાની રહેશે.</p>
(૪)	<p>આ ઉપરાંત યોજનાના ઠરાવ, એફીડેવીટ ફોર્મેટ, આવકનું પ્રમાણપત્રનો નમુનો, આચાર્ય પાસે મેળવવાનું પ્રમાણપત્રનો નમુનો વિગેરે યોજનાના વેબપોર્ટલ mysy.guj.nic.in પર ઉપલબ્ધ છે.</p>
(૫)	<p>વિદ્યાર્થીઓએ ઓફ-લાઈન અરજી સાથે નીચે મુજબના લાગુ પડતા દસ્તાવેજો જોડવાના રહેશે.</p> <ol style="list-style-type: none"> આધારકાર્ડની નકલ ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસ કર્યાની માર્કશીટની નકલ, ડી ટુ ડી પ્રવેશના કિસ્સામાં ડીપ્લોમા પાસ કર્યાની માર્કશીટ અને ડીપ્લોમા પ્રમાણપત્રની નકલ ડીગ્રી /ડીપ્લોમા અભ્યાસક્રમમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની નકલ,

	<p>5. વર્ષ ૨૦૧૫-૧૬ અને વર્ષ ૨૦૧૬-૧૭ માં ટ્યુશન ફી ભર્યાની પહોંચોની તમામ નકલ,</p> <p>6. નોટરાઈઝ્ડએફીડેવીટ (અસલમાં) (ફોર્મેટ વેબસાઈટ પરથી મેળવી લેવું.)</p> <p>7. વાલીની વર્ષ ૨૦૧૪-૧૫ ની આવકના મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની નકલ</p> <p>8. હોસ્ટેલ ફી તથા જમવાની પહોંચની નકલ,</p> <p>9. નેશનલાઈઝ્ડ બેન્કમાં બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ</p> <p>10. સ્નાતક/ડીપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષ ની માર્કશીટની નકલ/ પ્રથમ બે સેમેસ્ટરના માર્કશીટની નકલ</p> <p>11. આચાર્યશ્રી પાસેથી મેળવવાનું પ્રમાણપત્ર (અસલમાં) (ફોર્મેટ વેબસાઈટ પરથી મેળવી લેવું.)</p>
(૬)	<p>ઓફલાઈન અરજીના ફોર્મમાં માંગ્યા મુજબની તમામ સાચી વિગતો ભરી વિદ્યાર્થી તથા વાલીએ ફોર્મમાં દર્શાવેલ જગ્યા પર પોતાની સહી કરવાની રહેશે તથા ફોર્મમાં જરૂરી વિગતો ભરી સંસ્થાના આચાર્યશ્રી પાસે ચકાસણી કરાવી ફોર્મમાં દર્શાવેલ જગ્યા પર સહી-સંસ્થાનો સિક્કો કરાવી લેવાનો રહેશે.</p>
(૭)	<p>ઓફલાઈન અરજી કરતા વિદ્યાર્થીઓએ અસલ દસ્તાવેજોની ચકાસણી માટે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવી ઓફલાઈન અરજી જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવી પહોંચ (Acknowledgement receipt) મેળવી લેવાની રહેશે.</p> <ul style="list-style-type: none"> • અભ્યાસક્રમવાર હેલ્પ સેન્ટરોની યાદી વેબપોર્ટલ mysy.guj.nic.in પર ઉપલબ્ધ છે.
(૮)	<p>વિદ્યાર્થીએ પોતાનો આધારનંબર પોતાના નેશનલાઈઝ્ડ બેંક ખાતા સાથે અચૂક લિંક કરાવવાનો રહેશે. આધારનંબર બેંક ખાતા સાથે લિંક છે કે નહિ તે *૯૯*૯૯# પર ફોન કરવાથી જાણી શકાશે.</p>